

COVID-19 દરમિયાન વિકાસને આગળ વધારવા સીટીએ નવા ડિજિટલ ટૂલ્સ રજૂ કર્યા

બ્રમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 24, 2020) – સીટી ઓફ બ્રમ્પટને રહેવાસીઓ અને કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષાનું સંરક્ષણ કરવાની સાથે સાથે, COVID-19 મહામારી દરમિયાન વિકાસ યોજનાઓને આગળ વધવા દેવા પોતાના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં (આયોજન અને વિકાસ વિભાગમાં) નવીન પ્રક્રિયાઓ અને નવા ટૂલ્સ રજૂ કર્યા છે.

ડેવલપર્સ હવે સબડિવિઝનના (પેટા-વિભાગના) પ્લાન્સ, રિઝોનિંગ અને સાર્ટ પ્લાન્સ સહિત, વિકાસને લગતી તમામ અરજીઓ ઇલેક્ટ્રોનિકલી સીટીની [વેબસાઈટ](#) પર રજૂ કરી શકે છે. આ ટૂલ માર્ચ 20 માં સ્થાપવામાં આવ્યું ત્યારથી, સીટીને 25 નવી વિકાસ અરજીઓ મળી છે. સ્ટેકહોલ્ડર્સ (ભાગીદારો) સાથે વીડિયો ટેલીફોન્કન્ફરન્સિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને રિમોટલી (દૂરસ્થ) કામ કરતી વખતે કર્મચારીઓ તમામ અરજીઓની પ્રક્રિયા કરી શક્યા છે.

અત્યારે એપ્રિલ 20 માં, રહેણાક ઇમારતની પરવાનગીઓ માટેની અરજીઓ ઇલેક્ટ્રોનિકલી પણ રજૂ કરી શકાય છે. બિલ્ડિંગ ડિવિઝનના કર્મચારીઓ કબજવાળી ઇમારતના નિરીક્ષણો (બીજ એકમો સહિત) વર્ચ્યુઅલી (વાસ્તવમાં) કરી રહ્યા છે. બહુ વિશાળ ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ એન્ડ ઇન્સ્ટ્રુક્ટ્યુશનલ (ICI - ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય) અરજીની રજૂઆતો માત્ર એપોઈન્ટમેન્ટથી ચાલુ રહેશે.

કર્મચારીઓએ COVID-19 મહામારી દરમિયાન ઘણી વિકાસ યોજનાઓ માટે અને નીચે જણાવેલ સહિતની નોંધપાત્ર યોજનાઓ પર કામ ચાલુ રાખવાની મંજૂરી આપી છે:

- લગભગ 22,000 ચોરસ મીટર જેટલી રોજગાર માટેની જગ્યા અને 800 રહેણાક એકમોને મંજૂરીઓ.
- સીટીના ચીફ બિલ્ડિંગ અધિકારીએ મેપલ લોન્જ ફાર્મને બિલ્ડિંગ પરમીટ આપી, આ પ્રોજેક્ટથી 250 નવી નોકરીઓ ઊભી થશે.
- ધી શોપર્સ વર્લ્ડ રિડેવલપમેન્ટ (RioCan), જેણે 5,000 થી વધારે રહેણાક એકમો વડે, સાર્ટને નવા શહેરી મિશ્રિત-ઉપયોગાધિન સમુદાયમાં પરિવર્તિત કરવાની દરખાસ્ત મૂકી છે.

આ વર્ષના માર્ચ અને એપ્રિલ મહિનાઓને વર્ષ 2019 નાં એ જ સમયગાળા સાથે સરખાવતા સીટીએ 34 ટકા વધારે પરવાનગીઓ આપી. આપેલી નોંધપાત્ર પરવાનગીઓમાં સામેલ છે:

- મેપલ લોન્જ ફાર્મ – બાંધકામ મૂલ્ય \$2.5 મિલિયન
- શેલ, 6475 મેફિલ્ડ રોડ – બાંધકામ મૂલ્ય \$2.95 મિલિયન
- 17 નાઈટ્સબ્રિજ રોડ – બાંધકામ મૂલ્ય \$1.2 મિલિયન
- 1 નાઈટ્સબ્રિજ રોડ – બાંધકામ મૂલ્ય \$500,000

COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સમુદાયને સહાયરૂપ થવા સીટી દ્વારા કરવામાં આવતા પ્રયત્નો પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/COVID19 અથવા Twitter, Facebook અને Instagram પર @CityBrampton ને અનુસરો.

અવતરણો (ક્વોટ્સ):

“એક સુશાસન શહેર (વેલ-રન સીટી) તરીકે, અમે આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાનું સંરક્ષણ કરવાની સાથે સાથે બ્રેમ્પટનમાં ધંધાને આગળ વધારવા કટિબદ્ધ છીએ. આ નવીન પ્રક્રિયાઓ અને સાધનો અમને આપણાં શહેરમાં બાંધકામ આગળ વધારવાનું અને નવી નોકરીઓ ઊભી કરવાનું ચાલુ રાખવા, અને COVID-19 મહામારી દરમિયાન શારીરિક અંતર જાળવવાનું - એમ બંને કરવા દેશે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“શહેરની સગવડો બંધ છે ત્યારે, કાઉન્સિલ અને કર્મચારીઓ ધંધાઓને આગળ ધપાવવા વૈકલ્પિક રીતોથી સર્વિસીસ આપવા સતત પ્રયત્નશીલ છે. આયોજન વિભાગમાં ઉપયોગમાં લેવાતી નવી ટેકનોલોજી બ્રેમ્પટનના ધંધાઓને અસરકારક રીતે સેવા આપશે, સ્થાનિક અર્થતંત્રને સહાયરૂપ બનશે અને કર્મચારીઓને સુરક્ષિત રાખશે.”

- માર્ટિન મેડેરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ

“આરોગ્ય અને સુરક્ષા પર ધ્યાન આપીને, અમે આ પડકારભર્યા સમય દરમિયાન આપણાં શહેરની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા કટિબદ્ધ છીએ. સેવાઓ પૂરી પાડવાની નવી રીતો શોધીને, સીટી ઓફ બ્રેમ્પટન ડેવલપર્સ માટે ચડિયાતી પસંદગી બની રહેવાનું ચાલુ રહેશે.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ

“સીટી ઓફ બ્રેમ્પટનના કર્મચારીઓ આ પડકારભર્યા સમય દરમિયાન નવી અને સુરક્ષિત રીતોથી કાર્યક્રમો અને સેવાઓ આપવા અમારા સમર્પણમાં એકમત ધરાવે છે. આયોજન વિભાગમાં રજૂ થયેલી પ્રક્રિયાઓ અને સાધનો આ કટોકટી દરમિયાન કર્મચારીઓ અને જાહેર જનતાનું આરોગ્ય અને સુખાકારીનું સંરક્ષણ કરવાની સાથે સાથે ડેવલપમેન્ટ કમ્યુનિટીને સેવા આપવાનું અમને ચાલુ રાખવા દેશે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca